

Seat No. : _____

JA-117

January-2021

M.A., Sem.-III

504 : Economics

Time : 2 Hours]

[Max. Marks : 50

PART – I

નીચે આપેલા આઠ પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણના જવાબ લખો :

42

1. ભારતની નાણાકીય વ્યવસ્થાનું અવલોકન કરો.
2. મૂડીબજારના આર્થિક સુધારાઓની ચર્ચા કરો.
3. IPO એટલે શું ? IPOની પ્રક્રિયા સમજાવો.
4. ડેરિવેટીવ બજાર ઉપર નિબંધ લખો.
5. નાણા બજારમાં તરલતાને સુઆયોજિત કરવા માટેના જુદા-જુદા સાધનોની ચર્ચા કરો.
6. સમજાવો :
 - (i) ફોરવર્ડ બજાર
 - (ii) ઓપ્શન
7. ચર્ચા કરો.
 - (i) વાણિજ્ય પેપર
 - (ii) સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ
8. નાણાકીય વ્યવસ્થાના જુદા-જુદા ઘટકો ચર્ચો.

PART – II

9. નીચેના આઠ એમસીક્યુમાંથી કોઈપણ ચાર એમસીક્યુ લખો :

8

- (1) નાણાં બજારનું _____ સાધન જે આંતરરાષ્ટ્રીય વેપાર માટે સરળતાનું કારણ બને છે.
 - (a) યુરોડોલર ડીપોઝીટ
 - (b) રિપોઝ (Repos)
 - (c) બેંકર્સ એક્સચેન્જ
 - (d) વિદેશી વિનિમયનો વીમો
- (2) નાણાંકીય સાધનને જે તે કિંમતે ચોક્કસ સમયના ગાળામાં ખરીદવાના અધિકારને _____
 - (a) પુટ ઓપ્શન
 - (b) કોલ ઓપ્શન
 - (c) પ્રીમિયમ
 - (d) સ્વેપ

- (3) ફ્યુચર્સના કરારો Marked to Market છે.
- દરેક અઠવાડિયાના અંતે
 - દરેક મહિનાના અંતે
 - દરેક દિવસના અંતે
 - દિવસમાં બે વાર, બપોરે અને બજાર બંધ થાય ત્યારે
- (4) કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને Arbitrager કહેવાય જ્યારે
- જુદા-જુદા બજારમાંથી એક સાથે ખરીદી અને વેચાણ થાય
 - જુદા-જુદા બજારમાં કિંમતમાં તફાવત ઊભો કરે
 - ગ્રાહક અને વેચનારના ઝઘડા હલ કરે
 - જુદા-જુદા સમયગાળામાં ઓછું ખરીદી અને વધારે વેચે
- (5) Future Contractની સરખામણીએ, Forward Contracts
- Standardised નથી
 - ખરીદનાર અને વેચનાર વચ્ચેના સીધા સંપર્ક કરતા મધ્યસ્થીથી થાય છે
 - ઓછું ઔપચારિક બજાર
 - ડીલીવરી વધારે વખત કરવામાં આવે છે
- (6) નાણાંકીય મધ્યસ્થીની ઉત્પાદકીય કાર્યક્ષમતા ત્યારે કહેવાય જ્યારે _____ ન્યૂનતમ હોય.
- બચત કરનારનું જોખમ
 - લેણદારથી ચુકવણી કરતું વ્યાજ અને બચત કરનારે ચૂકવવું પડતું વ્યાજ વચ્ચેનો Spread
 - મધ્યસ્થીનો નાણાંકીય નફો
 - નાણાંકીય સંસ્થાનું જોખમ
- (7) નાણાંકીય મધ્યસ્થી અસ્તિત્વમાં નહિ આવે જો
- અર્થતંત્ર લાંબાગાળે, સ્થિર આર્થિક સમતુલામાં પહોંચે
 - લેવડહેવડનો ખર્ચ પણ અસ્તિત્વમાં ન હોય
 - હરીફાઈનું દબાણ એવું ન હોય કે જે લોકોને સ્વાર્થી સ્વકેન્દ્રિય બનાવે
 - મૂડીવાદની જગ્યાએ સમાજવાદ આવે
- (8) એ કઈ પ્રક્રિયા જે આવકના પ્રવાહની સારી રીતે આગાહી કરીને તેને ધનસંપત્તિમાં બદલી કરે
- Capitalization
 - Profiteering
 - Securitization
 - હેજીંગ

Seat No. : _____

JA-117

January-2021

M.A., Sem.-III

504 : Economics

Time : 2 Hours]

[Max. Marks : 50

PART – I

Instruction : Write any **three** answers from the following eight questions :

42

1. Give the overview of Financial System of India.
2. Discuss the economic reforms in Capital Market.
3. What is IPO ? Explain the process of IPO.
4. Write an essay on Derivative Market.
5. Discuss the various tools for managing liquidity in money market.
6. Explain : (i) forward market (ii) options
7. Discuss : (i) Commercial Papers (ii) Certificate of Deposits
8. Discuss the various components of financial system.

PART – II

9. Attempt any **four** MCQs from the following eight MCQs :

8

- (1) The money market instruments most conducive to the flow of international trade are :
 - (a) Eurodollar deposits
 - (b) Repurchase agreements (repos).
 - (c) Banker's acceptances
 - (d) Foreign Exchange Insurance
- (2) The right to purchase a financial instrument at a stated price within a specific period of time is called as :
 - (a) put option
 - (b) call option
 - (c) premium
 - (d) Swap

- (3) Futures contracts are “marked to market”.
- (a) at the end of every week
 - (b) at the end of every month
 - (c) at the end of every day
 - (d) twice daily, at noon and at market close
- (4) An arbitrageur is an individual or organization that will :
- (a) simultaneously buy at low and sell at high in different market.
 - (b) create disparities between prices in different markets.
 - (c) resolve disputes between consumers and sellers.
 - (d) buy low and sell high at different time periods.
- (5) Compared to future contracts, forward contracts
- (a) are not standardized
 - (b) involve an intermediary or exchange, rather than direct contact between buyer and seller
 - (c) have less formal markets
 - (d) make delivery most often
- (6) Productive (technical) efficiency in financial intermediation involves minimization of :
- (a) default risks to savers
 - (b) the spread between interest paid by borrowers and interest payments to savers
 - (c) financial profits to intermediaries
 - (d) default risk to financial intermediaries
- (7) Financial institutions would not exist if :
- (a) the economy reached a long-run, steady-state, economic equilibrium.
 - (b) transaction costs were also no-existent.
 - (c) competitive pressures did not make people so greedily self-interested.
 - (d) capitalism was replaced by socialism.
- (8) The process whereby reasonably predictable flows of income are converted into wealth is called :
- (a) Capitalization
 - (b) Profiteering
 - (c) Securitization
 - (d) Hedging
-